



26/08/2021

To,
BSE Limited
Phiroze Jeejeebhoy Towers
Dalal Street,
Mumbai - 400 001.
Scrip Code: 500356

To,
National Stock Exchange of India Limited
Exchange Plaza, C-1, Block - G,
Bandra Kurla Complex, Bandra(E),
Mumbai - 400 051
Symbol: RAMANEWS

Dear Sir/Madam,

Subject: Submission of Newspaper Advertisement w.r.t. 30th Annual General Meeting Notice, Book Closure and E-voting information.

Pursuant to Regulation 30 of Securities and Exchange Board of India (Listing Obligation and Disclosure Requirements) Regulations, 2015, we hereby submit Newspaper Advertisement published on 26th August, 2021 informing the Members - Notice, Book Closure and E-voting information w.r.t. 30th Annual General Meeting of the Members of the Company to be held on **Saturday, 18th September, 2021 at 11.00 a.m. (IST)** through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM).

1. Financial Express - English
2. Financial Express - Gujarati

Please update the same on your records.

Thanking You,

FOR, SHREE RAMA NEWSPRINT LIMITED


(Siddharth Chowdhary)
Executive Director
DIN: 01798350



SHREE RAMA NEWSPRINT LIMITED

Registered Office & Manufacturing Plant

📍 Village Barbodhan, Taluka Olpad, District Surat, 395 005, Guj., India
☎ 02621 - 224203,4,5 📠 02621 - 224206
✉ ramanewsprint@ramanewsprint.com
🌐 www.ramanewsprint.com

CIN : L21010GJ1991PLC019432

Marketing Office

📍 4th Floor, Wembley Building, Near Adarsh Petrol Pump, Nehru Road, Vile Parle (East), Mumbai - 400 057
✉ marketing@ramanewsprint.com
🌐 www.ramanewsprint.com

SPAN DIVERGENT LIMITED
(CIN: L74999GJ1980PLC003710)
Regd. Office: 9th Floor, Rajhans Bonista,
Behind Ram Chowk Temple, Ghod Dod Road, Surat - 395 007.
Tel. No.: 0261 2663232. Email: secretarial@span.co.in. Website: www.span.in

NOTICE

NOTICE is hereby given that

- 41st Annual General Meeting of the Shareholders of the Company will be held on Monday, September 27, 2021 at 11:30 a.m. (IST) through video conferencing or other audio visual mode in accordance with the Circulars dated April 08, April 13, and May 05, 2020 and January 13, 2021 issued by Ministry of Corporate Affairs and amendments thereto.
- Notice of the said meeting will be made available on www.span.in and www.bseindia.com.
- Register of Members shall remain closed from September 21, 2021 to September 27, 2021 (both days inclusive)
- For above purpose, the AGM Notice and Annual Report will be sent to e-mail addresses of members registered with the Registrar & Transfer Agent and Depository Participants as per the aforesaid circular.
- In this regard, the members whose email ids are not registered are hereby requested to register/update their email id with their respective depository participants or with Accurate Securities & Registry Private Limited (the Company's RTA) by following below instructions.
Send request to the Company's RTA on their email address info@accuratesecurities.com with subject line (Unit: Span Divergent Limited) mentioning Folio No / Client ID and DP ID, Name of Shareholder, Scan Copy of the Share Certificate, Self Attested Scan Copy of PAN and Aadhar Card or can register their email ID by accessing link: https://accuratesecurities.com/data-update.html
- The Company is providing the remote e-voting facility as well as e-voting facility during the meeting. The members who have not registered their email address with the Company/RTA can also cast their vote through the remote e-voting and during the meeting. Detailed procedure for remote e-voting and e-voting shall be given in Notice.

For Span Divergent Ltd.
Viral P. Desai
Managing Director

Place: Surat
Date: August 26, 2021

IDBI Bank Ltd
NPA Management Group, IDBI Complex,
Opp. Murti Staff Quarters, Near LalBunglow,
Off C. G. Road, Ahmedabad - 380 006.

Public Notice about Willful Defaulter

Name of the Director/ Guarantors

1. **Shri Chetan Tolani** (Ex-Director of Jaihind Projects Limited [since taken over by Resolution Applicant under CIRP]), C/54, Westend Park, Bodakdev, Ahmedabad-380054.
2. **D COM System Limited** (Corporate Guarantor of Jaihind Projects Limited [since taken over by Resolution Applicant under CIRP] 311, 3rd Floor, Venue Atlantis Corporate Park, Anandnagar Road, Satellite, Ahmedabad-380015.
3. **Jaihind Green Energy Ltd.** (Corporate Guarantor of Jaihind Projects Limited [since taken over by Resolution Applicant under CIRP] 301, 3rd Floor, Venue Atlantis Corporate Park, Anandnagar Road, Satellite, Ahmedabad-380015.

It is hereby notified to the public at large that the above mentioned Director and Guarantors failed and neglected to pay the instalments of principal, interest and other monies to IDBI Bank Ltd. with respect to the financial assistance granted to the Borrower (M/s Jaihind Projects Limited [since taken over by Resolution Applicant under CIRP]). The Director/ Guarantors are required to pay the outstanding sum of **Rs.433.97 crore as on August 31, 2020** together with interest thereon till the date of payment in terms of various loan documents executed by them in favour of IDBI Bank Ltd. Hence, in public interest it is informed and cautioned that no person shall deal with the any of the properties of the Director/Guarantors as huge dues are to be recovered from them.

Sd/-
Date : 25.08.2021
Place : Ahmedabad
Authorised Signatory
IDBI Bank Ltd., (NPA Management Group)

POSSESSION NOTICE

Whereas the Authorised Officer of Asset Reconstruction Company (India) Limited (Arcil) under Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act 2002, and in exercise of powers conferred under Section 13 (12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued Demand Notices under Section 13 (2) of the said Act, calling upon the following borrowers to repay the amounts mentioned against their respective name together with interest thereon at the applicable rates as mentioned in the said notices, within 60 days from the date of receipt of the said Notices, along with further interest as applicable, incidental expenses, costs, charges etc incurred till the date of payment and/or realization.

Sl. N.	Borrower Name /Co-Borrower Name / Loan Account No./ Selling Bank	Total outstanding (In Rs.) / Demand Notice as on Date	Date & Type of Possession
1	Mr. Deepak Ganeshbhai Kahar/Ms. Lataben G Kahar / Mr. Paresh Kumar Shah/ 10399217970 /State Bank of India	Rs. 4,06,075.72 as on October 06, 2015	Symbolic 21-Aug-21
2	Mr. Ramesh Shankarbhai Bhatiya/Mrs. Vasanti Ramesh Bhatiya/ LBBRD0000354349/ ICICI Bank Ltd.	Rs. 3,78,197.66 as on May 12, 2011	Symbolic 21-Aug-21
3	Mr. Samirbhai Laxmanrao Durve / Mrs. Shital Laxmanrao Durve/ BRDHL16000315 / BRDHL16000316 / L&T Financial Services	Rs. 94,07,062.22 as on June 06, 2018	Symbolic 21-Aug-21
4	Mr. Mehulbhai G Parmar / Mrs. Kajalben Mehulkumar Parmar/603807210223659 / Fullerton India Home Finance Company Ltd.	Rs. 14,24,770.57 as on March 16, 2019	Physical 23-Aug-21

Secured Property : Flat No. D/302, 3rd Floor Tower N D Paragraj Society, Hami-Varasia Ring Road, Vadodra Sy. No. 245, T P No 5, F P No. 172, Vill Saved, Dist: Vadodra - 391110, Gujarat

Secured Property : Flat No. A-502, 5th Floor (Lower Upper), Crystal White, Bih. Nilarbar, Vasna-Bhayali Road, Vadodra, Gujarat

Secured Property : Rajkot Revenue Survey No.249 P. City Survey Ward No. 11, TP No. 8, F.P. No. 155 P. Hudko Quarter No. C-54, Nr. Hudko Bus Station, Bih. Fire Briged, Kuvadvra Road, Rajkot - 360002, Gujarat

Whereas the borrowers mentioned hereinabove have failed to repay the amounts due, notice is hereby given to the borrowers mentioned hereinabove in particular and to the public in general that the Authorized Officer of Arcil has taken Symbolic / Physical Possession of the Properties/Secured Assets described herein above in exercise of powers conferred on him under Section 13 (4) of the said Act read with Rule 3 of the said Rules on the dates mentioned above. The borrowers mentioned here in above in particular and the public in general are hereby cautioned not to deal with the aforesaid Properties/Secured Assets and any dealings with the said Properties/Secured Assets will be subject to the charge of Arcil.

Place: Gujarat
Date: 26.08.2021
Sd/- Authorised Officer
Asset Reconstruction Company (India) Ltd.

Asset Reconstruction Company (India) Ltd.,
CIN : U65999MH2002PLC134884, Website : www.arcil.co.in

Registered Office: The Ruby, 10th Floor, 29 Senapati Bapat Marg, Dadar (West), Mumbai - 400 028. Tel: 022-6658130

Branch Address: 610, 6th Floor, Sun Square, Near Hotel Regenta Central Antim, Off C. G. Road, Navrangpura, Ahmedabad - 380 006, Gujarat. Tel: 079 - 4030631 / 102

SHREE RAMA NEWSPRINT LIMITED
CIN: L21010GJ1991PLC019432

Registered Office: Village: Barboadhan, Taluka: Olpad, District: Surat-395 005, Gujarat, India
E-mail: ramanevoting@ramanevoting.com Website: www.ramanevoting.com
Phone no.: 02621 - 224203/04/05

NOTICE OF THE 30th ANNUAL GENERAL MEETING, BOOK CLOSURE AND REMOTE E-VOTING INFORMATION

Notice is hereby given that the 30th Annual General Meeting ("AGM") of the Members of Shree Rama Newprint Limited ("Company") will be held on **Saturday, 18th September, 2021 at 11.00 a.m.** through Video Conferencing (VC)/ Other Audio Visual Means (OAVM) to transact the business, as set out in the Notice of the 30th AGM dated 14th August, 2021. The Company has sent out the Annual Report along with Notice convening AGM on Tuesday, 24th August, 2021, through electronic mode to all the Members whose e-mail IDs are registered on first cut-off date i.e. **13th August, 2021** with the Company's Registrar & Share Transfer Agent by M/s. National Securities Depository Limited ("NSDL") Depository Participant(s) in accordance with the Circular issued by the Ministry of Corporate Affairs dated 5th May, 2020 read with circulars dated 8th April, 2020 and 13th April, 2020, May 5, 2020, 15th June, 2020, 13th January, 2021 and also Securities Exchange Board of India, vide its circular dated 12th May, 2020 and 15th January, 2021 ("Circulars"). The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.ramanevoting.com, BSE Limited at www.bseindia.com, National Stock Exchange Limited at www.nseindia.com and on the website of NSDL at www.evoting.nsdl.com.

Notice is also hereby given that pursuant to the provisions of section 91 of the Companies Act, 2013, (Act) the Register of Members and Share Transfer Books of the Company will remain closed from Sunday, 12th September, 2021 to Saturday, 18th September, 2021 (both days inclusive) for the purpose of 30th AGM of the Company.

Pursuant to the provisions of Section 108 of the Act and Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the Securities and Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015, members are provided with the facility to cast their vote by 'Remote e-voting' and also 'e-voting' at the time of AGM on all the resolutions set forth in the said 30th AGM Notice dated 14th August, 2021.

Members may further note that:

- The voting rights of the members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on **Saturday, 11th September, 2021** (cut-off date).
- The remote e-voting period commences on **Wednesday, 15th September, 2021 at 9.00 a.m.** and will end on **Friday, 17th September, 2021 at 5.00 p.m.** During this period, the Members may cast their vote electronically. The remote e-voting module shall be disabled by NSDL thereafter.
- The Members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.
- Those Members, who shall be present in the AGM through VC/OAVM facility and had not cast their votes on the Resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM.
- The manner of remote e-voting and voting at the AGM by members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM.
- Any person, who acquires shares of the Company and becomes a Member of the Company after the Notice has been sent electronically by the Company and holds shares as on the cut-off date i.e. **Saturday, 11th September, 2021**; may obtain mail voting login id and password by sending a request over email at evoting@nsdl.co.in mentioning demat account number/folio number, PAN, name and registered address. However, Members who are already registered with NSDL for e-voting can use their existing User Id and Password for casting their vote through remote e-voting/e-voting at the AGM.

In case you have any queries or issues, you may refer the Frequently Asked Questions ("FAQs") for Shareholders and e-voting user manual for Shareholders at the download section of www.evoting.nsdl.com or contact Mrs. Sarita Mote (Assistant Manager) at evoting@nsdl.co.in or call on toll - free no. 1800-1020-990 or 1800 22 44 30.

For, SHREE RAMA NEWSPRINT LIMITED
Sd/-
PK. MUNDRA
President (Finance), CFO & Company Secretary
(Membership No. - F3937)

DATE : 25.08.2021
PLACE : Barboadhan

Asahi Songwon Colors Limited
Regd. Office: 'Asahi House', 13, Aaryans Corporate Park, Nr. Shilaj Railway Crossing, Thaltej - Shilaj Road, Thaltej, Ahmedabad - 380 059, Gujarat. Tel: 079-68325000. email: cs@asahisongwon.com, www.asahisongwon.com, CIN:L24222GJ1990PLC014788

NOTICE

Notice is hereby given that in compliance with the provisions of Section 124(6) of the Companies Act, 2013 and Investor Education and Protection Fund Authority (Accounting, Audit, Transfer and Refund) Rules, 2016 and amended from time to time, the Company is mandated to transfer all such shares to the name of Investor Education and Protection Fund (IEPF) Account in respect of which dividends has not been paid or claimed by the shareholders for consecutive seven years or more.

Notice is further given that in accordance with the provisions of the IEPF Rules, shares of those shareholders who have not encashed their dividends for seven consecutive years from 2013-14 will be transferred to the IEPF Authority by the due date as per the stipulated procedures. Individual notices have been already sent to respective shareholders at their latest available address with the Company/Registrar and Share Transfer Agent (RTA) records, inter alia, providing the details of shares being transferred to IEPF authority and details of such shareholders is also available in the website of the Company.

It may be noted that to Company with the aforesaid requirement, the Company will take necessary steps to transfer of unclaimed shares as per the procedure mentioned in the IEPF Rules. After the said shares have been transferred to IEPF, concerned shareholder may claim said shares from IEPF authority by making an application. No claim shall lie against the Company in respect of unclaimed shares transferred to the demat account of IEPF pursuant to the Rules.

For further information/request to claim unclaimed shares, the concerned shareholders may contact to the Secretarial Department of the Company at the above mentioned address.

For, Asahi Songwon Colors Limited
Mrs. Paru M. Jaykrishna
Chairperson and Mg. Director

Place: Ahmedabad
Date: 25.08.2021

AKSHAR SPINTEX LIMITED
CIN : L17291GJ2013PLC075677

Regi. Office : Revenue Survey No. 102/2 Paiki, Plot No. - 2 Village : Haripar, Ranuja Road, Tal : Kalavad Jannagar - 361013 (Gujarat)

Notice to the Members for 8th Annual General Meeting

Notice is hereby given that the 8th Annual General Meeting ("AGM") of the members of Akshar Spintex Limited ("the Company") shall be held on **Wednesday, 29th September, 2021 at 2:00 p.m.** IST through Video Conferencing ("VC")/ Other Audio-Visual Means ("OAVM") without physical presence of the members at a common venue, to transact the businesses as set out in the Notice of the AGM.

In accordance with the General Circulars issued by the Ministry of Corporate Affairs and Securities and Exchange Board of India, Notice of 8th AGM along with Annual Report for the F.Y. 2020-21 will be sent through electronic mode only to those members whose email addresses are registered with the Company and Depositories Participant. The requirement of sending physical copies of the Annual Report has been dispensed with. Members can update their e-mail address and Bank Account details by request to the concerned Depository Participant with whom they have opened their demat account. If your email address is registered with the Company/ Depositories Participant, the log in credentials for remote e-voting are being sent on your registered mail. Please note that same login credentials are required for participating in the AGM through VC and voting on resolutions during the AGM.

The Annual Report of the Company for the F.Y. 2020-21 containing Notice of 8th AGM will be also available at the website of the Company <http://www.aksharspintex.in/annual-report.html> and may also be accessed from the website of the Stock Exchange i.e. BSE Limited ("BSE"). The AGM Notice is also be available on the Website of National Securities Depositories Limited ("NSDL") at www.evoting.nsdl.com.

Members who have not registered their mail address will be able to cast their vote electronically on the business set forth in the Notice of AGM either remotely (during e-voting period) or during AGM as per the manner provided in the Notice to the members. The Instructions for joining AGM and Voting shall also be provided in the Notice of AGM and uploaded on the website of the Company <http://www.aksharspintex.in/> and the website of the NSDL at www.evoting.nsdl.com. Members who have not registered/updated their email addresses with the Company/their Depositories Participants or members who have not received Annual Report, AGM Notice and voting instructions are requested to register their mail id at cs@aksharspintex.in by providing their valid DP/Client ID, PAN No. Mobile No and E - Mail ID.

By order of Board of Directors,
FOR, AKSHAR SPINTEX LIMITED
Place: Haripar (Jannagar) Sd/-
Date: 26/08/2021 Harikrushna S. Chauhan
Chairman & Whole Time Director

20

INDIAN EXPRESS

I arrive at a conclusion not an assumption.

Inform your opinion with detailed analysis.

The Indian Express. For the Indian Intelligent. **THE INDIAN EXPRESS** JOURNALISM OF COURAGE

SIGMA SOLVE LIMITED
CIN: L72200GJ2010PLC060478

Regd. Office: 305-308, 3rd Floor, Alpha Megaconne, Sindhu Bhavan Road, S.G. Highway, Ahmedabad-380054 Phone: 07929708387
Website: www.sigmasolve.in E-mail: cshah@sigmasolve.net

NOTICE OF THE 11th ANNUAL GENERAL MEETING AND E-VOTING INFORMATION

NOTICE is hereby given that the Eleventh Annual General Meeting (AGM) of the Company will be held on Friday, September 17, 2021 at 01:00 p.m. (IST) through video conferencing ("VC")/ other audio visual means ("OAVM") to transact the business, asset out in the Notice of the AGM. The Company has sent the Notice of AGM along with Annual Report for Financial Year 2020-21 on 25th August, 2021, only through electronic mode, to the Members whose e-mail id were registered with the Company/Depositories, in accordance with the Circulars issued by Ministry of Corporate Affairs dated May 5, 2020 read with its circulars dated April 08, 2020, April 13, 2020 & January 13, 2021 and SEBI circular dated May 12, 2020 and January 15, 2021.

As per Section 108 of the Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 as amended and Regulation 44 of the SEBI (LODR) Regulations, 2015 and Secretarial Standards on General Meetings ("SS2") issued by Institute of Company Secretaries of India, members are provided with facility to cast their vote on all the resolutions set forth in the said Notice, using electronic voting system (e-voting) provided by Central Depository Services (India) Limited. The voting rights of the Members shall be in proportion to the equity shares held by them in the paid-up equity share capital of the Company as on Thursday, 09th September, 2021 ("cut-off date"). The details as required pursuant to the provisions of the Companies Act, 2013 and Rules made thereunder are given below:

- The Book Closure period shall commence on 09th September, 2021 and end on 17th September, 2021 (Both Days Inclusive);
- The remote e-voting shall commence on Tuesday, 14th September, 2021 at 09:00 a.m. (IST) and end on Thursday, 16th September, 2021 at 05:00 p.m. (IST);
- Cut-off date for determining rights of entitlement of e-voting is Thursday, 09th September, 2021;
- The members will not be allowed to vote through remote e-voting beyond the period as specified above;
- Shareholder acquiring the shares of the Company and becomes Members of the Company after sending of the Notice and holding Shares as of the Cut-off date may follow steps mention in the Notice of AGM to exercise their voting rights;
- E-voting facility will be available during the AGM. Members who have cast their votes by remote e-voting on resolutions before the AGM, may remain present at the AGM through VC/OAVM but shall not be entitled to cast their vote on such resolutions again;
- The Board has appointed M/s. Mukesh H. Shah & Co., Company Secretaries as Scrutinizer to scrutinize the e-voting procedure, who shall submit the results of voting to the Chairman;
- In case shareholders have any queries regarding e-voting, they may refer the Frequently Asked Questions ("FAQs") and e-voting manual available at www.evotingindia.com, under help section or send an e-mail at helpdesk@cdslindia.com or contact at 022-23058542/43.

By Order of the Board of Director
For, Sigma Solve Ltd.
Sd/-
Prakash Ratilal Parikh
Chairman & Managing Director
(DIN:03019773)

Place: Ahmedabad
Date: August 26th, 2021

PRASHANT INDIA LIMITED
REGD. OFFICE: Block No.456, N.H. No. 8, Palsana Char Rasta, Palsana, Tal. Palsana, Dist. Surat 394315, CIN: L15142GJ1983PLC006574, Ph. 9375055557.
E-mail: cs.prashantindia@gmail.com. Website: www.prashantindia.info

NOTICE

(For the kind attention of Shareholders of the Company)

Sub-Registration of E-mail ID and Bank Account Details

In view of the continuing Covid-19 pandemic, the Ministry of Corporate Affairs ("MCA") has vide its Circular No.02 dated January 13, 2021 & 20 dated May 5, 2020 read with Circular No. 14 dated April 8, 2020 and Circular No. 17 dated April 13, 2020 (hereinafter collectively referred to as "MCA Circulars") permitted the holding of Annual General Meeting through VC or OAVM without the physical presence of Members at a common venue.

The Notice of the Annual General Meeting along with the Annual Report for the financial year 2020-21 is to be sent only by electronic mode to those Members whose email addresses are registered with the Company/Depositories in accordance with the aforesaid MCA Circulars and circular issued by SEBI dated January 15, 2021 & May 12, 2020. The 38th Annual General Meeting of the Company will be held on 29th September, 2021 at 11.00 A.M through Video-Conferencing/OAVM. Process of Registration of email ID and Bank Account details:

- In the case of Shares held in Physical mode :**
Kindly mail Folio No, Name of Shareholder, PAN (selfattested scan copy of PAN card), Contact no., E-mail address and bank account details along with scan copy of cancel cheque of your bank to MCS SHARE TRANSFER AGENT LIMITED - mcsstaahmd@gmail.com
- In the case of Shares held in Demat mode :**
The shareholder may please contact the Depository Participant ("DP") and register the email address and bank account details in the demat account as per the process followed and advised by the DP. In case the share holders have any queries on the subject matter and Rules, they may contact the Company at Tel: 9375055557 & Email :- cs.prashantindia@gmail.com.

For Prashant India Limited
Swati Babulal Joshi
Company Secretary

Place : Surat
Date : 26-08-2021

GANESH HOUSING CORPORATION LIMITED
(CIN: L45200GJ1991PLC015817)

Regd. Office : Ganesh Corporate House, 100 Feet Hebalpur Thaltej Road, Nr. Sola Bridge, Off: S.O. Highway, Ahmedabad - 380 054 (P). 079 6160 8888 (F). 079 6160 8899 (W). www.ganeshhousing.com (E): secretarial@ganeshhousing.com

NOTICE FOR 30th ANNUAL GENERAL MEETING

NOTICE is hereby given that the 30th Annual General Meeting (AGM) of the Members of Ganesh Housing Corporation Limited will be held on Thursday, 30th September, 2021 at 3.00 P.M. IST through video conferencing (VC) / other audio visual means (OAVM) to transact the businesses specified therein.

The Company has sent Annual Report along with Notice convening 30th AGM on 23rd August, 2021, through electronic mode to the members whose email addresses are registered with the Company and Depositories in accordance with the circular issued by the Ministry of Corporate Affairs dated 5th May, 2020 read with circulars dated 8th April, 2020, 13th April, 2020 and 13th January, 2021 and Securities and Exchange Board of India circulars dated 12th May, 2020 and 15th January, 2021. The Annual Report along with the Notice convening the AGM is also available on the website of the Company at www.ganeshhousing.com website of BSE Ltd. at www.bseindia.com and on the website of Central Depository Services (India) Limited (CDSL) at www.evotingindia.com.

NOTICE is further given pursuant to Section 91 of the Companies Act, 2013 read with Regulation 42 of SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015 ("SEBI LODR") that the Register of Members and the Share Transfer Books of the Company will remain closed from Thursday, 23rd September, 2021 to Wednesday, 29th September, 2021 (Both days inclusive) for the purpose of 30th AGM.

NOTICE is also given pursuant to the provisions of Section 108 of Companies Act, 2013 read with Rule 20 of the Companies (Management and Administration) Rules, 2014 and Regulation 44(1) of SEBI LODR that the Company is providing its members facility to exercise their rights to vote by electronic means on all the resolutions proposed to be passed at the 30th AGM of the Company. The shareholders are requested to note the following information:

- The Shareholders of the Company holding shares either in physical form or in dematerialized form, as on the cut-off date i.e. Thursday, 23rd September, 2021, may cast their votes electronically for businesses as detailed in the Notice calling 30th AGM. In this regard the Company has appointed CDSL for providing remote e-voting facility. The remote e-voting module shall be disabled thereafter.
- Day, Date and Time of commencement of remote e-voting - Monday, 26th September, 2021 at 9:00 a.m. (IST)
- Day, Date and Time of end of remote e-voting through electronic means - Wednesday, 29th September, 2021 at 5:00 p.m. (IST)
- The Board of Directors has appointed Mr. Jain Parikh, Partner of M/s. J. M. Parikh & Associates, Practicing Chartered Accountants, Ahmedabad as a Scrutinizer.
- Those members, who shall be present in the AGM through VC/OAVM facility and has not cast their votes on the resolutions through remote e-voting and are otherwise not barred from doing so, shall be eligible to vote through e-voting system during the AGM. The members who have cast their votes by remote e-voting prior to the AGM may also attend/participate in the AGM through VC/OAVM but shall not be entitled to cast their votes again.
- Any person, who acquires shares of the company and becomes a member of the company after the sending of the Notice and holding shares as of the cut-off date i.e. Thursday, 23rd September, 2021, may obtain the login ID and password by following the steps mentioned in the Notice of the AGM.
- Shareholders holding physical or demat shares whose email ids are not registered with the Company may register the same by sending email to Company viz. secretarial@ganeshhousing.com or on the e-mail ID of our Registrar and Share Transfer Agents - MCS Share Transfer Agent Ltd. viz. mcsstaahmd@gmail.com (specifically mentioning Unit: Ganesh Housing Corporation Limited) by providing following necessary details
a) For Physical shareholders- please provide necessary details like Folio No., Name of shareholder, scanned copy of the share certificate (front and back), PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card).
b) For Demat shareholders- please provide Demat account details (CDSL-16 digit beneficiary ID or NSDL-16 digit DPID + CLID), Name, client master or copy of Consolidated Account statement, PAN (self-attested scanned copy of PAN card), AADHAR (self-attested scanned copy of Aadhar Card).
- The detailed process and manner of e-voting has been mentioned in the Notice of 30th AGM which is available on the website of the Company i.e. www.ganeshhousing.com and the website of agency i.e. www.evotingindia.com.
- Any grievances connected with electronic voting shall be addressed to Mr. Rakesh Dalvi, Sr. Manager (CDSL) Central Depository Services (India) Limited, A Wing, 25th Floor, Marathon Futurex, Midland Mill Compounds, N.M. Joshi Marg, Lower Panel (East), Mumbai - 400 013 or send an email to helpdesk.evoting@cdslindia.com or call 022-23058542/43.

Date: 25.08.2021
Place: Ahmedabad
For Ganesh Housing Corporation Limited
Sd/- Shekhar G. Patel Managing Director

Bandhan Bank

Demand Notice to Borrowers

The under mentioned account turned into N.P.A and demand notice is issued by Bandhan Bank Ltd. to the following borrower(s) under sec.13(2) of the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act (The Act), 2002 which was returned unserved. Hence, this notice is issued to you all and public at large through publication.

Name of and borrower(s), Loan Account No.	Description of mortgaged property (Secured Asset)	Date of Demand Notice/ Date of NPA	O/S Amount as on Date of Demand Notice	Date of Pasting of Notice
Mr. Jatinkumar Bikhhabhai Patel Mrs. Ansuayaben Jatinkumar Patel 110/3603	All that piece and parcel of the immovable property admeasuring about 1109.00, 565, City Survey No.1085, 1086, New City Survey No.1085, Sit No.60, Fp#102, Flat No.102, Rushi Arcade, Opp-Ambika Bus Stand Highway road, Kalol, Gandhinagar Gujarat-382721 and bounded by: North: First floor Flat No.103 East: Passage West: Balcony South: Flat wall	15.07.2021/ 30.04.2020	Rs.32,41,580.12	27.07.2021
Mr. Manojkumar Kishorlal Bhatiya Mrs. Alpna Hirdey Bhatiya 110/3566	All that piece and parcel of the immovable property admeasuring about 808.00sq. Ft, 1137 Fp#201,Block D, Flat No.201 Umriya Residency, Nr. Gayatri Temple Highway road, Kalol, Gandhinagar, Gujarat-382721 and bounded by: North: Margin Space East: Society Road West: Flat No.D-202 South: Society Road	15.07.2021/ 29.02.2020	Rs.12,81,496.67	27.07.2021
Mr Rashminkumar Ashokkumar Patel Mrs Shitalben Rashminkumar Patel 110/6110	All that piece and parcel of the immovable property admeasuring about 778.00 sq. ft. Cs No-91 Paiki, Tika No-7/4, Ward No-5 Final Plot No. 7/4; Tenament No-7/4, Mahadev Vado, Kumbhar Vas Panch Hatdi Bazar, Kalol, Gandhinagar Gujarat - 382721 and bounded by: North: Space of Maholla East: Property of Kumbhar Karshanbhai West: Property of Amatha Harjivanbhai South: House of Pandiya Harjivan	15.07.2021/ 31.03.2020	Rs.10,49,687.22	12.08.2021

Demand made against you through this notice to repay to the Bank dues mentioned against your name with interest, costs and charges within 60 days from the date hereof, failing which the Bank will further proceed to take steps u/s.13(4) of the SARFAESI Act.

The borrowers'/mortgagor's attention is invited to the provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Place: Kalol
Date: 26/08/2021

Authorised Officer
BANDHAN BANK LIMITED

Regional Off.: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad 380 006. Ph. 26421671-75

